

## योएल

**ब्रेक्ब मुरः** योएल आ नें आ अर्थ “परमप्रभु यावे, परमप्रभु बाक्ब” देंशो बाक्ब। मेको आ आफ पेथुएल आ पर्बम मारेइ मतुंइसीब। योएलम यहूदा राज्यमी परमप्रभु आ लोक्व पशो बाक्त।

**गेना ब्रेक्शोः** मुर काम अथाल्याहम आंम कली पिपीम सेल्सेनु, पिप आ तौ योआश चढ़ेब येहो-यादाम परमप्रभु आ खिंम खुइशशा वोइशशो ना, ८०० बि. सी.म खोदेंशो एको किताब ब्रेक्शो बाक्ब, दे मिन्नीम।

**मार ब्रेक्शोः** मालेपुकीमी इसाएल रागी कली निकशी खेयप रागी नेल्ल खतम सेल्तेक्म। रेउ मयितीके परमप्रभु यावे आ गेशो सजाइ बाक्त। मोपतीके योएलम मुर आन कली परमप्रभु यावे गे लेतीन। परमप्रभु यावेम आ गे लेश्शो मुर आन कली माफ गेब। योएल २:१३ आन साम्शो नेल्ल लेप्ब। योएल २:२५ योएलमी “इसाएली ला ममाइ, अर्को रागी डा मुरपुकीमी यो, परमप्रभु यावे आ श्येत रे प्रोइशो तने चाप्नीम” देंशो बाक्ब।

### सल्हा मालेमी श्येत गेशो

**१** परमप्रभु यावेमी पेथुएल आ तौ योएल कली देंशो लोक्व एको बाक्ब।

**२** मिनु मेको लोक्व मार बाक्त देंशा हना “गे खाल्पापुकी, एको लोक्व नेनीन। रागीम बाक्ब मुर नेल्ल इन नोफा दाइशशा नेनीन। मार, इन ब्रोइतीक नाक्ती नु इन किकी पिपी आन ब्रोइतीक नाक्तीम ओदेंशो दुम्शो बाक्मे?

**३** गे एको लोक्व इन तमी तौ आन कली देनीन। मिनु इन तमी तौपुकीमी आन तमी तौ आन कली देंपतीन। मिनु मेकोपुकीमी आन चच युइ आन कली देमल।

**4** घांस ख्रोइशशा ब्वाइब मालेपुकीमी मार मार प्रोन्मे, मेको लेस्वा मालेपुकीमी नेकतेकम। मिनु लेस्वा मालेपुकीमी मार मार प्रोन्मे, मेको तोड़ले मालेपुकीमी नेकतेकम। मिनु तोड़ले मालेपुकीमी मार मार प्रोन्मे, मेको सल्हा मालेपुकीमी नेकतेकम। योएल २:२५

**5** मिनु गे दुक्शा बाक्बपुकी सेंसीशा, डाक्कीन। मिनु अडगुर शांबु तूशा दुक्ब नेल्ल नक अडगुर शांबु आ पर्बम रोंका पने। मारदे हना मेको इन शोव्र रे रोंइसीशो बाक्ब।

**6** ठेयब रागी डा मुरपुकी आं रागीम ओव्रतेकम। मेको सक्ति पाइशशो नु हिक्ने मचाज्चा डा पा शुश बाक्नीम। मेको आ खुइ गुप्स आन खुइ खोदेंशो बाक्नीम। मिनु मेको आन लाइशशो खुइ, छाउरी गुप्स आ खुइ खोदेंशो बाक्नीम। योएल २:२

**7** मेकोपुकीमी आं अडगुर रू खतम पोक्शा, आं फोव्रशी रवा नेल्ल तिम्शा चेत्तेकम। मेकोपुकीमी मेको आन कोक्ते नेल्ल थुरशा, ताइक्ताक्म। मेको आन राशी नेल्ल बुश दुम्तेकम।

**8** मिनु कन्ने मीश आलमी अरन्डी फेक्शा, आ ग्युंबे पचशो वोंइश आल आ पर्बम दोपा रोंका पाइबा, मोपा रोंका पने।

**9** अन्न चढ़ेतीके नु तूचा थोव्रक चढ़ेतीके परमप्रभु यावे आ खिंमी चढ़ेचा देक्शो बाक्ब। परमप्रभु यावे आ डोंइती गेय पाइब चढ़ेबपुकी रोंका पाइनीम। योएल २:१४

**10** मिनु रू नेल्ल श्येत्थ दुम्शो बाक्नीम। खप रोंका पाइब। मारदे हना अन्न नेल्ल खतम दुम्शो बाक्ब। अडगुर आ रस सोव्रत। तेल रवा आन फल सोव्रतेकम।

**11** गे रूम गेय पाइबपुकी सुर्ता पने। अडगुर खुम्बपुकी रोंका पने। क्योव्रज चेरब आ पर्बम यो रोंका पने। मारदे हना बाली नाली खतम दुम्शो बाक्नीम।

**12** अडगुर बोट सोल सुल बेक्तेकम। फोव्रशी रवा यो सोव्रतेकम। अनार, खजूर, स्याउ रवा नु रू डा रवा नेल्ल सोव्रतेकम। थमा पा, मुर आन दातेमी मुर आन ग्येरतीक थुं यो मेको खोदेंशो पा नुश्शो

બાકબ ।

**13** ચઢેબપુકી, સુર્તા પા અરન્ડી ફેકશા રોંકા પને । ચઢેતીકેમી ગેય પાઇબપુકી રોંકા પને । આં પરમપ્રભુ આ ગેય પાઇબપુકી, નાકદો યો સુર્તા પા અરન્ડી ફેકશા બાકકીન । મારદે હના ઇન પરમપ્રભુ આ ખિંમી અન્ન ચઢેતીકે નુ તૂચા થોવ્રક ચઢેતીકે દેકશો બાકબ ।

**14** મિનુ માઇજા બાકચા કલી મુર આન કલી ખુપ્તીન । પરમપ્રભુ યાવે આ ખિંમ રાગીમ બાકબ મુર નેલ્લ બુકશા, ખાલ્પા આન કલી બ્રેતીન । ગે ખાલ્પા નુ મુર આન કલી પરમપ્રભુ યાવે, ઇન પરમપ્રભુ આ ખિંમ પુકીન । મિનુ પરમપ્રભુ યાવે કલી ઠેયબ સેંદા પા ‘વારચ પાઇક્કી’ દે પુનીન” દેંત । ભજન સંગ્રહ ૧૦૪:૧૦,૧૧; યોએલ ૨:૧૫

### યોએલમી રોંકા પશો

**15** મિનુ યોએલમી “પરમપ્રભુ યાવે આ જાકચા ચિકશો નાકત આ પર્બમ આબી આબી, મારદે હના મુલ મેકો નાકત જાકબ । નેલ્લ ક્યેડા સક્તિ પાઇશશો ખતમ પોકીને જાકબ । યોએલ ૨:૧; યસૈયા ૧૩:૬

**16** માર, ઇં જચા થોવ્રક ઇં ડોંડી રે મરોઇકસે ડા? માર, ગ્યેરશા સોમ્શા બાકતીકે આંઇ પરમપ્રભુ આ ખિં રે મયોલ્મ ડા? બ્યવસ્થા ૧૬:૩૧

**17** વાંચેર નેલ્લ ખપ આગામ સોવ્રશા રોમ્શા લીતેકમ । અન્ન વોઇક્તીક ખિં બ્રેશશો બાકનીમ । અન્ન વોઇક્તીક શ્યેત્થ દુમ્તેકમ । મારદે હના અન્ન મદુમ ।

**18** મિનુ બસ્તુ ભાવ રોંકા પાઇનીમી । બી બ્યફ જોતીક મબાકતીકે હિરના હિરન બાકનીમ । ક્યારશ ભેડા આન હુલ યો શ્યેત જશો બાકનીમ ।

**19** પરમપ્રભુ યાવે, ગો ઇન કલી વાઇ બ્રેશશા થોઇનુંડ । મારદે હના બી બ્યફ નુ ક્યારશ ભેડા આન જોતીકે મીમ નેકશો બાકબ । મિનુ મીમ રૂ ડા રવા નેલ્લ નેકશો બાકબ । યોએલ ૨:૩

**20** મિનુ બ્વાકી ડા જન્તુપુકીમી યો ઇન કલી થોશો બાકનીમ । મારદે હના ખોલા સોવ્રશો બાકનીમ । મિનુ મીમ ગોરશો રાગી ડા બસ્તુ

ভাব যোগ্যতীক ডা ঘাংস নেল্ল নেকশো বাকব” দেংত। ভজন সংগ্রহ  
১০৪:১০-১১

## 2

### পরমপ্রভুম নিসাফ পচা চিকশো

**১** সিয়োনমী তুরাহী তাপ্পীন। আঁ ডাংডামী শুশ গ্রীব তাপ্তীক গ্রোগ  
তাপ্পীন। রাগীম বাকব মুর নেল্ল গিক গিক পা খিংখি পামেকল।  
মারদে হনা পরমপ্রভু যাবে আ জাকশো নাকত নেকথা জাকশো বাকব।  
মেকো জাকচা চিকশো বাকব। যোগী ১:১৫

**২** মেকো নাকতী ছিড়ছিড় নু হিংচা ডা বাকব। মেকো থম ঠেয়ব  
গোস্স নু ছিড়ছিড়মী সুম্শো বাকব। মিনু ঠেয়ব সক্তি পাইশশো  
লডাই পাইব আন হুলমী ডাংডা আন কলী ক্যের গোস্সুম সুম্শো  
খোদেংশো পা সুম্শো বাকনীম। মেকো মোদেংশো ড়োঁইতী গেনাযো মদুম্শো  
বাকত। মিনু নোলে ডা মুর আন পালাম যো মোদেংশো গেনাযো মদুম্ব।  
যোগী ১:৬; প্রস্থান ১০:১৩-১৫

**৩** মেকো আন ড়োঁড়োঁইতী মীম মারেই মারেই নেকব। মিনু মেকো আন  
নোনোলে মী ব্রাইব। মেকো আন ড়োঁইতী রূপুকী এদেন ডা ফল ফুল  
রূ খোদেংশো বাকনীম। মেকো আন নোলে গোরশো রাগী খোদেংশো দুম্নীম।  
মেকোপুকী রে মারেই মব্রোঁইনীম। যোগী ১:১৯

**৪** মেকো আন কুল শারা আন কুল খোদেংশো বাকনীম। লডাই পাইব  
শারা ডোঁকব খোদেংশো পা বারনীম।

**৫** মেকোপুকী বগগী দোরশো রেয়কে খোদেংশো পা পহাড তার দোরনীম।  
মীম আইক্য শী দাকশো খোদেংশো পা রেয়কে পাইনীম। মেকোপুকী  
সক্তি পাইশশো লডাই পাইব আন হুলমী লডাই পচা চিকশো  
খোদেংশো বাকনীম।

**৬** মিনু জাত জাত ডা মুর মেকো আন কলী তশা হিংশা, আন কুল  
রাব কিকপাইকনীম।

**7** मेकोपुकी लडाइ पाइबपुकी खोदेंशो पा बारशा, गारो डोंइसीनीम। मेको का का पा आन गाकशो लां मप्रोंइथु, आन लांम गाकनीम।

**8** मेकोपुकी मचुमुथु गाकशा, लां का खोइकनीम। मिनु या कुरशो आन जोरी सत्रु आन हुलम ओवङ्नीम। मिनु सुइमी मेको आन कली तेक्ने मचाप्नीम।

**9** मेकोपुकी सहर कली लडाइ तोचा कली गारो तार दोरनीम। मेकोपुकी खिं डा झेल रे खुइ खोदेंशो पा ओवङ्नीम।

**10** मिनु मेको आन डोंइती रागीम खिनु कुइब। सरीड हिम्सीब। नां नु तास्ला छिडछिड दुम्नीस। मिनु सोरुलमी आन हाम्सो मकोंइनीम। योएल ३:४; यसैया १३:१०

**11** मिनु परमप्रभु यावे आ लडाइ पाइब आन डोंइती ठेयब सेंदा पा लोव पाइब। मेको आ लडाइ पाइब सक्ति पाइशशो नु शुश बाकनीम। मिनु मेको आ देंशो टीब हिक्ने मचाप्चा डा बाकनीम। परमप्रभु यावे आ निसाफ पतीक नाकती ठेयब नु थम हिंचा डा बाकब। मेको सुम फाल्ने चाप्नीमी डा?

### परमप्रभुमी “आं गे लेतीन” देशो

**12** परमप्रभु यावेमी “इन थुं नेल्लेमी आं गे लेतीन। गे माइजा बाकशा, डाकशा नु रोंका पा आं गे लेतीन। इजीकीएल ३३:११

**13** गे रोंका पा इन वा मखाक्कीन। इन थुं खाक्कीन। गेपुकी परमप्रभु यावे, इन परमप्रभु गे लेतीन। मारदे हना मेकोमी शिशी पा दाकब। मेको रीब पा मगाइकब। गेना हना यो दाकब नु रीब पा सजाइ मगेब बाकब। प्रस्थान ३४:६

**14** मिनु परमप्रभु यावेमी आ थुं लेशशा, सजाइ मगेथु, आसीक गेबा को? मेको सुम तुइकबा डा? मिनु गेपुकीम परमप्रभु यावे, इन परमप्रभु कली अन्न चढेतीक नु तूचा थोवङ्क चढेतीके चढेने। योना ३:९

**15** સિયોનમી તુરાહી તાપ્તીન । માઇજા બાક્ચા કલી મુર આન કલી ખુપ્તીન । મિનુ ચાડ માનેચા કલી મુર આન કલી બ્રેત્તીન । યોએલ ૧:૪

**16** મુર નેલ્લ આન કલી ખુપ્તીન । બુક્શો મુર નેલ્લ આન કલી પરમપ્રભુ યાવે આ ડોંડીઠી ઠીક સેલીન । ખાલ્પા આન કલી ખુપ્તીન । આલ આન કલી ખુપ્તીન । દૂધ તૂબ આલ આન કલી યો ખુપ્તીન । ગ્યુમ્લે આ કોઠા રે ગૂલ । મિનુ ગ્યુમ્લી આ બાક્તીક રે જાક્લ ।

**17** પરમપ્રભુ યાવે આ ડોંડીઠી ગેય પાઇબ ચઢેબપુકી પરમપ્રભુ યાવે આ ખિં ડા પિંડી નુ ચઢેતીક આ દાતેમ ડાક્મલ” દેત । મેકોપુકીમી “પરમપ્રભુ યાવે ઇન મુર આન કલી સજાઇ મગેને । રાગી રાગી ડા મુર આન ડોંડી ઇન મુર આન કલી શુક્શી નુ તોકશા લોવ્ર પાઇક્તીક દુંચા મગેને । મિનુ જાત જાત ડા મુરપુકીમી ‘માર, મેકો આન પરમપ્રભુ તે બાકમ?’ દેંચા મતામેક્લ” દેંતેક્મ । ભજન સંગ્રહ ૭૯:૧૦

### પરમપ્રભુમી લોવ્ર લેશ્શો

**18** મિનુ પરમપ્રભુ યાવેમી આ રાગી આ પર્બમ રુશ પા, આ મુર આન કલી શિશી પાપ્તુ ।

**19** મિનુ પરમપ્રભુ યાવેમી આ મુર આન કલી મિશા “ગો ઇન કલી અન્ન, અડગુર શાંબુ નુ તેલ સોઇકનન્ની । મિનુ ગે રૂનીની । મિનુ ગો ઇન કલી રાગી રાગી ડા મુર આન દાતેમી ગેનાયો શુક્શી પાઇક્તીક દુંચા મગેનન્ની । યોએલ ૨૬:૨૭

**20** ગો ઉત્તર રે જાક્શો લડાઇ પાઇબ આન કલી ઇન ક્યેડા ડોન ખેરનુંડમી । ગો મેકો આન કલી કોકત । મુલ ગોરશો રાગીમી ખેરનુંડમી । મેકો આન ડોંડીઠી ડા હુલ આન કલી પૂર્બ ડા સમુન્દ્ર ગે નુ મેકો આન નોલે ડા હુલ આન કલી પચ્છિમ ડા સમુન્દ્ર ગે ખેરનુંડમી । મિનુ મેકો આન રાક્શો રિના ઇર ગે લાઇબ” દે પરમપ્રભુમી દેંત । મેકોમી થમા પા ઠેયબ ગેય પશો બાક્બ ।

**21** રાગી ડા મુર મહિનીન । ગે ગ્યેરશા સોમ્સીશા બાક્કીન । પરમપ્રભુ યાવેમી ઠેયબ ગેય પશો બાક્બ ।

**22** ગે બ્વાકી ડા જન્તુ મહિનીન। મારદે હના ગોરશો રાગી ડા યોવ્તૃતીક ગિગી દુમ્શો બાક્બ। રવામ ફલ સિત્નીમ। ફોવ્રશી રવા નુ અડગુર આ બોટમી શુશ ફલ સિત્નીમ।

**23** ગે સિયોન ડા મુરપુકી ગ્યેરસીન। ગેપુકી પરમપ્રભુ યાવે, ઇન પરમપ્રભુ આ પર્બમ શુશ ગ્યેરસીન। મારદે હના મેકોમી આ ઠીક પતીકેમ ઇન કલી ડોંઝી ડા રેઉ ગેશો બાકત। મેકોમી ઇન કલી શુશ રેઉ ગેશો બાકત। ડોંઝી નુ નોલે ડા રેઉ ડોંઝી ખોદેશો પા ગેશો બાકત। યેરમીયા ૫:૨૪

**24** મિનુ ખલાપુકી અન્નમી બ્રીનીમ। ગરપુકી નક અડગુર શાંબુ નુ તેલમ બ્રીશા ક્યુણીમ।

**25** પરમપ્રભુ યાવેમી “ગો ઇન કલી લેસ્વા માલે, તોડલે માલે, સલ્હા માલે નુ ઘાંસ ખોઇશશા બ્વાઇબ માલે આન નેકશો નેલ્લ લેશશા ગેનન્ની। મેકો આં સોઇશશો લડાઇ પાઇબપુકી બાકતેકમ। ગો મેકો આન કલી ઇન દાતેમી સોઇકતાકડમી। યોએલ ૧:૪

**26** મિનુ ગે શુશ જચા તશા રૂનીની। મિનુ ઇન પર્બમ છક લાક્ચા ડા ગેય પાઇબ પરમપ્રભુ યાવે, ઇન પરમપ્રભુ આ નેં ઠેયબ સેલ્ચા માલ્નીની। મિનુ આં મુરપુકી લેંશા ગેનાયો મુને મદોકનીમ। બ્યવસ્થા ૮:૧૦

**27** ગો ઇસાએલી આન દાતેમી બાકશો બાકનુંડ। ગો પરમપ્રભુ યાવે, ઇન પરમપ્રભુ નડું। આં ક્યેડા લાક્શા, અર્કો પરમપ્રભુ મબાક્બ, દે ગે તુડક્ચા માલ્નીની। મિનુ આં મુરપુકી લેંશા ગેનાયો મુને મદોકનીમ।

### પરમપ્રભુ આ સોકત મોઇક્તીકે

પ્રેરિત ૨:૧૬-૨૧

**28** મિનુ નોલે ગો આં સોકત મુર નેલ્લ આન તાર મોઇકનુંડ। મિનુ ઇન તમી તૌપુકીમી આં લોવ્ર પાઇનીમ। ઇન ખાલ્પાપુકીમી ડોમુ તાઇનીમ। મિનુ ઇન વોંઝ આલપુકીમી આં કોંઝશો તાઇનીમ। ગન્તી ૧૧:૨૯; યસૈયા ૪૪:૩; ઇજીકીએલ ૩૯:૨૯; તીતસ ૩:૫-૬

**29** મેકો નાક્તી ગો વાઇલીમ વાઇલ આન તારી યો આં સોકત મોઇકનુંડ।

**30** ગો સરીડ નુ રાગીમ ચિન્ડ કોંઇનુડમી। હુશ, મી નુ કુન કે થામ કોંઇનુડમી। હોસે ૭:૧

**31** પરમપ્રભુ યાવે આ ઠેયબ હિંચા ડા નાકત જાકચા ક્યેડા ડોંઝી  
નાં છિડછિડ દુમ્બ। મિનુ તાસ્લા હુશ દુમ્બ” દેંશો બાકબ। યોએલ  
૨:૨, ૧૦, ૧૧; મત્તી ૨૪:૨૯; પ્રકાશ ૬:૧૨

**32** મેના પરમપ્રભુ યાવે આ નેં થોડિબ નેલલ બ્રોંચા તાઇનીમ। મારદે  
હના પરમપ્રભુ યાવેમી દેંશો ખોદેંશો પા સિયોન ડાંડા નુ યરૂસલેમમી  
પરમપ્રભુ યાવેમી બ્રેશશોપુકી બ્રોંચા તાઇનીમ। મિનુ મેકો પ્રોંશો  
આન દાતેમી પરમપ્રભુ યાવે આ યોવ્રશો મુર બાકનીમ। રોમી ૧૦:૧૩;  
ઓબદિયા ૧૭

### 3

મુર આન કલી નિસાફ પશો

**1** પરમપ્રભુ યાવેમી “મેકો નાકતી ગો યહૂદા નુ યરૂસલેમ આસ  
રિસ્થો દુત્તીક નાકતી લેશશા ચાકનુડ। હોસે ૭:૧

**2** મિનુ ગો રાગી રાગી ડા મુર નેલલ આન કલી ખુષ્ણા, યેહો-શાફાત  
આ દિમમી ચાકનુડમી। મિનુ મેકેર મેકો આન કલી નિસાફ પાઇનુડ।  
મારદે હના મેકોપુકીમી આં મુર આન કલી રાગી રાગી ડા મુર આન  
દાતેમી બ્રપાઇક્ટેકમ। મિનુ આં રાગી ભાગ ભાગ સેલ્ટેકમ।

**3** મેકોપુકીમી આં મુર આન પર્બમ ફેન્ટે ગ્યારતેકમ। મિનુ વોંઝશ  
આલ લેયશા, તેલ્લેમ નુ લામ્નેકમ। મીશ આલ આન કલી લેયશા,  
અડગુર શાંબુ તૂતેકમ।

**4** ટાયર, સીદોન નુ પલિસ્તી આન રાગી ડા મુરપુકી આં કલી માર  
પાઇનીની ડા? માર, આં પશો આ પર્બમ આં કલી ક્યેકક લેત્નીની?  
ગેપુકીમી આં કલી ક્યેકક લેત્તાકની હના, ગો મેકો રીબ પા ઇન  
પિયા તાર મોઇનુડ।

**5** મારદે હના ગે આં સુન, ચાંદી નુ થમ રિસ્થો થોવ્રક નેલલ ઇન  
દરવારમ લાઇક્ટીની।

**6** मिनु गे यहूदा नु यरूसलेम डा मुर आन कली मेको आन रागी रे लाइशा, ग्रीस डा मुर आन कली लेयतीनी ।

**7** मुल गो मेको आन कली लेयशो रागी रे ग्रुंइशा, चाक्नुडमी । मिनु गो इन श्येत गेशो लेंशा इन पिया तार मोइक्नुड ।

**8** मुल गो इन तमी तौ आन कली यहूदा डा मुर आन कली लेयनुडमी । मिनु मेकोपुकीमी मेको आन कली डोन साबा रागी डा मुर आन कली लेयनीम ” दे परमप्रभु यावेमी देंशो बाकब ।

**9** मिनु परमप्रभुमी “एको लोक्त रागी रागी डा मुर आन दातेम नेंपतीन । लडाइ पचा कली ठीक दुमीन । लडाइ पाइब आन कली ब्रेत्तीन । बुक्तीक आ नेकथा जाकचा माल्नीम ।

**10** गे इन फाली शोल्शा, तुप्पा तरवार सेलीन । मिनु इन गुये तुप्पा, तूतीक भाला सेलीन । मिनु गे हिंब मुरपुकीमी ‘गो बोल्यो लडाइ पाइब नकी’ देनीन । यसैया २:४

**11** एर ओंथ बाकशो रागी रागी डा मुर नेल्ल रीब पा जाककीन । गे नेल्ल मेकेर खुम्सीन । परमप्रभु यावे, इन बोल्यो लडाइ पाइब आन कली उइ यितीन ।

**12** मिनु रागी रागी डा मुर नेल्ल जोंब बोकशा, खुम्सीशा येहो-शाफात आ दिममी लमल । मारदे हना गो एर ओंथ डा रागी डा मुर नेल्ल आन कली निसाफ पाइनुड ।

**13** मिनु इन गुयेमी रिकचा ठीक दुमीन । मारदे हना बाली नाली खुप्ची जाकशो बाकब । मिनु ओवशा अडगुर ख्राककीन । मारदे हना कोल ब्रीशो बाकत । गर ब्रीशा क्युप्शो बाकनीम । मेको खोदेंशो पा आन मरिम्शो पशो शुश दुम्त । प्रकाश १४:१५; यसैया ६३:३,६; प्रकाश १४:१८

**14** मिनु निसाफ पतीक दिममी शुश मुर जाकस डा जाकस बाकनीम । मारदे हना मेको दिममी परमप्रभु यावे आ निसाफ पतीक नाकती जाकचा चिकशो बाकब ।

**15** নাং নু তাস্লা ছিড়ছিড় দুম্নীস। মিনু সোরুলপুকীমী আন ছেড়ছেড় মকোঁইনীম” দেত। যোগ ২:১০; যোগ ৩:৪

**16** পরমপ্রভু যাবে সিয়োন রে ঠেয়ব সেংদা পা লোঁব পাইব। যুরুসলেম রে পা আ সেংদা নেংপাইকব। সরীড় নু রাগী খ্রিংখি পাইনীস। তন্ম পরমপ্রভু যাবে আ মুর আন কলী খুইশশা বাক্তীক নু ইস্মাইল ডা মুর আন কলী বৌল্যো ব্রোঁইশা বাক্তীক দরবার দুম্ব। আমোস ১:২

### পরমপ্রভু সিয়োনম বাক্ব

**17** “গো, পরমপ্রভু যাবে, ইন পরমপ্রভু আং ডাংডা সিয়োনম বাক্বনুড়, দে গে তুইকনীনী। মিনু যুরুসলেম আং কে দুম্ব। মিনু রাগী রাগী ডা মুর মেকো সহর ডা লাং রে পা মলাকনীম। ইজীকীএল ৩৪:৩০

**18** মেকো নাক্তী ডাংডাম শুশ অড়গুর সিত্নীম। মিনু পহাড়ম দুঁধ শুশ বাক্ব। যহূদা ডা খোলা নেল্লোমী ব্বাককু শাইকনীম। মিনু পরমপ্রভু যাবে আ খিং রে পা ব্বাককু বুক্তীকে শিত্তীম ডা দিম জিপ্পাইকব। আমোস ৯:১৩; ইজীকীএল ৪৭:১

**19** মিনু যহূদা ডা দোস মতাইব মুর আন কলী মরিম্শো পতীকে নু হুশ খ্বাকশ পোক্তীকে ইজীপ্ত রাগী মুর মবাক্তীকে দুম্ব। মিনু এদোম চাহিং কোক্ত রাগী দুম্ব।

**20** তন্ম যহূদা রাগীম গেনা হনা যো মুর বাকনীম। মিনু যুরুসলেম নেল্ল পালা ডা মুর আন কলী দুম্ব। ওৰিদিয়া ১০:-

**21** গো মেকো আন হুশ খ্বাকশ পোকশো ক্যেকক লেল্নুড়মী। মিনু আন পাপ মক্যাম্নুড়” দে পরমপ্রভুমী দেত। পরমপ্রভু যাবে সিয়োনম বাক্ব। ব্যবস্থা ৩২:৪৩; ইজীকীএল ৪৮:৩৫

परमप्रभु यावे आ लोकः

**Bible in Sunwar (NP:suz:Sunwar)**

copyright © 2011 Wycliffe Bible Translators, Inc.

Language: Sunwar

Translation by: Wycliffe Bible Translators, Inc.

**Copyright Information**

© 2011, Wycliffe Bible Translators, Inc. All rights reserved.

This translation text is made available to you under the terms of the Creative Commons License: Attribution-Noncommercial-No Derivative Works. (<http://creativecommons.org/licenses/by-nc-nd/3.0/>) In addition, you have permission to port the text to different file formats, as long as you do not change any of the text or punctuation of the Bible.

You may share, copy, distribute, transmit, and extract portions or quotations from this work, provided that you include the above copyright information:

You must give Attribution to the work.

You do not sell this work for a profit.

You do not make any derivative works that change any of the actual words or punctuation of the Scriptures.

Permissions beyond the scope of this license may be available if you contact us with your request.

Printed book ISBN 9789937101646

**The Bible without Deuterocanon**

in Sunwar

© 2011, Wycliffe Bible Translators, Inc. All rights reserved.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution-Noncommercial-No Derivatives license 4.0.

You may share and redistribute this Bible translation or extracts from it in any format, provided that:

You include the above copyright and source information.

You do not sell this work for a profit.

You do not change any of the words or punctuation of the Scriptures.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

2014-04-30

---

PDF generated using Haiola and XeLaTeX on 18 Apr 2025 from source files  
dated 29 Jan 2022  
27cd6a1c-0244-5add-a4e8-b4f0e5104473